

વિશ્વ વ્યાપાર સંગઠનના પરિપ્રેક્ષ્યમાં ફળ-શાકભાજીની નિકાસલક્ષી ખેતી

કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ , બં. અ. કૃષિ મહાવિદ્યાલય , ખાતે નાબાર્ડ તથા આણંદ જીલ્લા કો. ઓ. યુનિયન, આણંદ ના સહયોગથી તા.૨૦/૦૭/૨૦૧૭ ગુરુવારના રોજ ફળ અને શાકભાજીની નિકાસલક્ષી વૈજ્ઞાનિક ખેતી અંગે આણંદ અને ઉમરેઠ તાલુકામાં કાર્યરત ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO)ના ખેડૂત સભ્યો માટે એક દિવસીય તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમાર્થીઓના રજીસ્ટ્રેશન બાદ તાલીમ કાર્યક્રમનું વિધિવત્ત ઉદ્ઘાટન બં.અ. કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. કે. પી. પટેલ અને કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા ડૉ. કે. એસ. જાદવની ઉપસ્થિતિમાં થયું.

તાલીમ કાર્યક્રમને અનુલક્ષીને બં. અ. કૃષિ મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. કે. પી. પટેલ દ્વારા એક દિવસીય તાલીમમાં ભાગ લેનાર ફળ-શાકભાજી પકવતા ખેડૂતોને ખેતી અંગેની તાલીમની અગત્યતા તથા આણંદ કૃષિ યુનિવર્સિટીની રીસર્ચ તેમજ વિસ્તરણ શિક્ષણ અંગેની માહિતી આપી તેમજ તાલીમના વિષયને અનુરૂપ ઉદબોધન કર્યું તથા કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના વડા ડૉ. કે. એસ. જાદવે સંબંધિત વિષય અંગે તાલીમાર્થીઓને અવગત કરાવ્યા.

તાલીમની શરૂઆત જેમાં શાકભાજી સંશોધન કેન્દ્ર ના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. વી. આઈ. જોષી દ્વારા શાકભાજીના પાકોમાં ગુણવત્તા સભર બીજ ઉત્પાદન તથા વધુ ઉત્પાદન માટેની ખેતી પદ્ધતિ , બાગાયત કોલેજના સહ પ્રાધ્યાપક ડૉ. આર. આર. ગજેરા દ્વારા શાકભાજીના પાકોમાં નિકાસ માટેની ગુણવત્તા તથા મુલ્યવર્ધન તેમજ આણંદ જીલ્લા કો. ઓ. યુનિયનના એક્ઝીક્યુટીવ ઓફીસર શ્રી સુરેશભાઈ એસ. પટેલ દ્વારા ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની અંતર્ગત ફળ-શાકભાજીની નિકાસના આયોજન ઉપર વ્યાખ્યાનો રજૂ કર્યાં.

ભોજન વિરામ બાદ પેટલાદ તાલુકાના બોરીયા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી કેતનભાઈ પટેલ દ્વારા કેળ તથા બટાટાના પાકમાં સજીવ ખેતીના અભિગમ ઉપર પોતાના અનુભવોની તાલીમાર્થીઓ સમક્ષ છણાવટ કરી. ત્યારબાદ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. વી. કે. ગોંડલીયા દ્વારા ફળ-શાકભાજીની નિકાસની કમબંધ કાર્યવાહી વિશે માહિતી આપવામાં આવી. થીયરી સાથે પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે હેતુથી આણંદ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત તાલીમાર્થીઓને કરાવી જેમાં શાકભાજીની વિવિધ જાતો તથા શાકભાજી પાકોમાં આવતા રોગો અંગેની માહિતી પુરી પાડવામાં આવી.

અંતમાં તાલીમ કાર્યક્રમના આયોજક ડૉ. વી. કે. ગોંડલીયા દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

